



May 25, 2021

To,

National Stock Exchange of India Ltd. Exchange Plaza Bldg. 5 th Floor, Plot No.C-1 'G' Block, Near Wockhardt, BandraKurla Complex Mumbai 400 051. Fax:26598237/38 Scrip Code : DCW	BSE Limited, 1 st floor, New Trading Ring Rotunda Building, PhirozeJeejeebhoy Towers, Dalal Street, Mumbai - 400 001. Fax : 22723121/3719/2037/2039 Scrip Code :500117
--	--

Dear Sirs/Madam,

Sub: Newspaper Publication- Financial Results

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith extracts of the Audited Financial Results for the fourth quarter and Financial Year ended March 31, 2021, approved by the Board of Directors of the Company at their meeting held on May 21, 2021, published in the newspapers viz. Financial Express (English) and Financial Express (Gujarati).

This is for your information and records.

Thanking You,
Yours faithfully,

For DCW Limited


Name: Dilip Darji
General Manager (Legal) & Company Secretary
Membership No. ACS-22527



DCW LIMITED

HEAD OFFICE :
"NIRMAL" 3RD FLOOR, NARIMAN POINT, MUMBAI-400 021.
TEL.: 2287 1914, 2287 1916, 2202 0743 TELEFAX: 22 2202 8838
REGISTERED OFFICE : DHRANGADHRA - 363 315 (GUJRAT STATE)
Email: ho@dcwlimited.com, Website: www.dcwlimited.com, CIN-L24110GJ1939PLC000748

ઉંઝા યાર્ડમાં હરાજીથી વેપાર શરૂ થતાં ખેડૂતોને રાહત: જીરૂ, વરિયાળી, ઈસબગુલ, અખાની આવક શરૂ

કોમોડિટી બ્યુરો, ઉંઝા, તા. ૨૩

ઉંઝા માર્કેટમાં વિતેલા સમાહમાં હરાજી શરૂ થતાં નિયંત્રિત જણસીઓની આવકો જેટલા વેપાર થયા હતા. વિવિધ માલોની વરાકી રહેતાં સાધારણ વધઘટે બજારો એકંદરે ટકેલી હતી. ગત ગુરુવારથી શુદ્ધિ યાંત્રો રોટેશન પદ્ધતિથી જુદા જુદા માલોની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેથી બહારથી ખેડૂત અને વેપારી માલોની આવકો વધી હતી. યાંત્રો જે તે દિવસે જે

હજાર ગુણીની હતી. વેપાર સારા થયા હતા. હલકા માલના રૂ. ૧૩૦૦થી ૧૪૦૦ સાબરકાંઠા, અરવલી અને બનાસકાંઠાના બેસ્ટ કલર માલના રૂ. ૧૭૦૦થી ૨૨૦૦ અને આબુરોડના બેસ્ટ રંગદાર માલના રૂ. ૩૦૦૦થી ૩૩૦૦ સુધી રહ્યા હતા. વરિયાળીની પરદેશની ધીમાડને ગવલે નિકાસકારોની લેવાલી છે. હાલ વરિયાળીની સિંગાપુરમાં નિકાસ થાય છે. આ વર્ષે પરદેશની માંગનીકલાત અગાઉ સુધાર્યા મથાળે

મજબૂત હતા. હલકા માલના રૂ. ૨૨૦૦ અને સારા માલના ૨૪૦૦થી ૨૫૦૦ હતા. મેથીની પરચુરણ આવક હતી.

ઉંઝા બજાર મહેશ બારોટ

માલોની આવકો થઈ હતી તેના વેપાર થઈ ગયા હતા. એક દિવસે જીરૂ અને ઈસબગુલ તેમજ બીજા હતા તેના વેપાર થઈ ગયા હતા. એક દિવસે જીરૂ અને ઈસબગુલ તેમજ બીજા દિવસે વરિયાળી, અખાની, મેથી, રાય વગેરે માલોની હરાજી થકી વેપાર ધંધાના કામકાજ શરૂ થયા હતા. હરાજી શરૂ થવાથી બજારમાં બહારથી મર્યાદિત સંખ્યામાં ખેડૂતો માલો લઈને આવ્યા હતા.

જાણકારોના મતે લગભગ એક માસ સુધી યાર્ડ બંધ રહેતાં ખેડૂતોને પોતાની ખેત પેદાશોનું વેચાણ કરી શક્યા ન હતા. પરંતુ હવે રાખેતા મુજબ યાર્ડ શરૂ થતાં આગામી દિવસોમાં ખેડૂત માલોની આવકો વધવાની સંભાવના છે. આ સમાહે યાંત્રો ઉનાળુ તલની નવી આવકના શ્રીગ્રણે થયા હતા. મસાલાની ચીજ જીરાની દશમી બાર હજાર ગુણી જેટલી આવક થઈ હતી. વરાકી સારી હતી. નિકાસકારો, વેપારીઓની લેવાલીને કારણે ભાવનું વધારા થોડું સુધારા તરફી રહ્યું હતું. હલકા માલના રૂ. ૨૨૦૦થી ૨૩૦૦ મીડીયમ માલના રૂ. ૨૪૦૦ અને સારા માલના રૂ. ૨૪૫૦થી ૨૬૦૦ સુધીના હતા. મસાલાની ચીજ વરિયાળીની આવક નવથી દશ

NELCAST LIMITED
 CIN : L27109AP1982PLC003518
 Regd. Office: 34, Industrial Estate, Gudur - 524 101.
 Tel : 08624 - 251266. Fax : 08624 - 252066.
 Website : www.nelcast.com Email: nelcast@nelcast.com

NOTICE

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a Meeting of the Board of Directors of the Company will be held on Monday, the 31st May 2021 to consider and take on record Standalone and Consolidated Audited Financial Results of the Company for the quarter and year ended 31st March 2021 and recommendation of dividend if any, for the financial year ended 31st March 2021. This information is available on the website of the Company, www.nelcast.com and also on the website of the Stock Exchanges, www.bseindia.com and www.nseindia.com.

For NELCAST LTD.
 (S.K. SIVAKUMAR)
 Company Secretary
 Place: Gudur
 Date : 22nd May 2021.

DCW LIMITED
 Registered Office : Dhrangdhra - 363315 (Gujarat)
 Head Office : Nirmal, Nariman Point, Mumbai - 400021.
 Website : www.dcwtd.com, Telephone : 2227191616.
 Telefax : 22 2202858, E-mail : hw@dcwtd.com CIN : L24110GJ1989PLC000748 (In India)

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31st MARCH, 2021 :

Particulars	Quarter Ended 31.03.2021		Quarter Ended 31.12.2020		Quarter Ended 31.03.2020		Year Ended 31.03.2021		Year Ended 31.03.2020	
	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)
1. Total Income from operations	45,567.95	38,607.08	29,359.09	1,46,426.17	1,27,727.68					
2. Net Profit / (Loss) before tax for the period	1,872.07	894.89	(3,590.87)	1,387.51	(3,965.64)					
3. Net Profit / (Loss) after tax for the period	646.96	619.59	(2,505.74)	379.31	(2,676.16)					
4. Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	605.40	643.74	(2,461.07)	410.21	(2,579.56)					
5. Equity Share Capital of face value of ₹ 2/- each.	5,220.61	5,220.61	5,220.61	5,220.61	5,220.61					
6. Earning Per Share (of ₹ 2/- each) (for continuing and discontinued operations)										
1. Basic	0.25	0.24	(0.86)	0.15	(1.12)					
2. Diluted	0.25	0.24	(0.86)	0.15	(1.12)					

NOTES:
 The above is an extract of the detailed format of Standalone Audited Financial Results for the quarter and year ended on 31st March, 2021 filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results for the quarter and year ended 31st March, 2021 are available on the Stock Exchanges websites (www.bseindia.com, www.nseindia.com) and the company website (www.dcwtd.com).

For and on behalf of the Board of Directors
 Sd/-
 Pramod Kumar Jain
 Chairman & Managing Director
 Place : Mumbai
 Dated : 21st May 2021
 DIN : 00380458

DCW LIMITED - Manufacturers of CHEMICALS THAT MAKE INDUSTRIES HUM
 Visit us at : www.dcwtd.com

LUMAX Lumax Auto Technologies Limited
 CIN: L31909DL1981PLC349793
 Regd. Office: 2nd Floor, Harbans Bhawan-II, Commercial Complex, Nangal Raya, New Delhi- 110046 Tel: 0124-4780000, Email: shares@lumax.com Website: www.lumaxworld.in/lumaxautotech

TRANSFER OF UNPAID DIVIDEND AND THE UNDERLYING SHARES TO THE INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF)

Dear Shareholder(s), Pursuant to the provisions of Section 124 of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules"), as amended from time to time, every Company is required to transfer to the Investor Education and Protection Fund (IEPF), the money in the Unpaid Dividend Account of the Company which remains unpaid or unclaimed for a period of 7 (seven) years from the date it was transferred to Unpaid Dividend Account and transfer of shares to IEPF in respect of which dividend remains unpaid or unclaimed for 7 (seven) consecutive years or more to IEPF.

In view of above, we wish to inform you that the due date for transfer into IEPF of the Unpaid/Unclaimed Dividend lying in the Unpaid Dividend Account of the Company for the Financial Year 2013-14 is 27th August, 2021. Accordingly, concerned Shareholders are requested to claim the Unpaid Dividend.

The underlying shares of such Shareholders will also be transferred into the IEPF. After such shares are transferred to the IEPF, all voting rights on the same shall be frozen and you will lose all benefits accruing on your shares e.g. dividend, etc. as this shall also be transferred to the IEPF.

The complete list of Shareholders whose dividend(s) are lying unpaid against their Folio/DP-ID/Client ID, in the Unpaid Dividend Accounts of the Company beginning Financial Year 2013-14 onwards and also those whose shares are due for transfer to the IEPF is being uploaded on the website of the Company at www.lumaxworld.in/lumaxautotech under the Investor Section. The Company has sent individual communication to the concerned shareholders at their registered address whose shares are liable to be transferred to IEPF under the Rules for taking appropriate action(s).

The Company will follow the process as mentioned below:

- For the shares which are in physical form and which are liable to be transferred to the IEPF Authority, the concerned shareholders may note that the Company would be issuing duplicate share certificate(s) in lieu of the original share certificate(s) held by them and upon issue of the duplicate share certificate(s), the original share certificate(s) which are registered in their name will stand automatically cancelled and be deemed as non - negotiable as per the rules. After the issue of duplicate share certificate(s), the Company shall inform the depository by way of corporate action to convert the duplicate share certificate into the Demat form and transfer in favour of the Demat Account of the IEPF Authority.
- For the shares which are in Demat form, the Company will process the transfer of shares through depositories by way of Corporate Action in favour of the Demat Account of the IEPF Authority.

The concerned shareholders whose shares are in physical form may further note that their details uploaded on the website of the Company should be treated and considered as an adequate notice in respect of issue of duplicate share certificate(s) by the Company for the purpose of transfer of shares to the IEPF Authority as per the rules.

In case the Company does not receive any communication from the concerned shareholders, the Company with a view to adhering with the requirements of the Rules, transfer the dividend to the IEPF and the shares which are liable to be transferred to IEPF by the due date i.e. 27th August, 2021.

Please note that no claim shall lie against the Company in respect of unclaimed dividend amount and shares transferred to IEPF. Shareholders may claim the dividend and corresponding shares transferred to IEPF including all benefits accruing on such shares, if any, from the IEPF authorities after following the procedure prescribed in the Rules.

For any queries on the above matter, Shareholders are requested to contact the Company's Registrar and Share Transfer Agent, M/s Bigshare Services Private Limited, Unit: Lumax Auto Technologies Limited, Bharat Tinter Works Building, 1st Floor, Opp. Vasant Oasis, Makwana Road, Anchari-East, Mumbai-400059, Tel: 022 - 62638200, Email ID: vinod.y@bigshareonline.com.

For Lumax Auto Technologies Limited
 Anil Tyagi
 Company Secretary
 Place : Gurugram
 Date : 22/05/2021

NUCLEUS SOFTWARE EXPORTS LTD.
 CIN: L74899DL1989PLC034594
 Regd. Offt.: 33-35, Thyagraj Nagar Market, New Delhi-110003
 Tel.: +91-120-4031400; Fax.: +91-120-4031672
 Email: investorrelations@nucleussoftware.com
 Website: www.nucleussoftware.com

NOTICE

NOTICE is hereby given that pursuant to Regulation 29 and 47 of the SEBI (LODR) Regulations, 2015 meeting of the Board of Directors of the Company would be held on Thursday, June 3rd, 2021 to consider and approve:

- audited standalone financial results of the Company for the quarter and financial year ended March 31, 2021;
- audited consolidated financial results of the Company for the financial year ended March 31, 2021;

The Board would also consider recommendation of Final Dividend for the Financial Year ended 31st March 2021, if any in the above stated Board Meeting.

The financial results duly approved by the Board of Directors shall be declared at the conclusion of the Board Meeting on June 3rd, 2021.

The information contained in this notice is also available on the Company's website i.e. <http://www.nucleussoftware.com> (Investors) and also on Stock Exchanges website at www.bseindia.com and www.nseindia.com for details of Board Meeting.

For Nucleus Software Exports Ltd.
 Sd/-
 Date: May 23, 2021 Poonam Bhasin
 Place: Noida Company Secretary

આરતી ઇન્ડસ્ટ્રીઝ લીમિટેડ
 CIN:L24110GJ1989PLC0007301

રજીસ્ટર્ડ ઓફીસ: પ્લોટ નં.૮૦૧, ૮૦૧/૨૩, ઝુ.આઇ.ડી.સી. એસ્ટેટ, ફેઝ-૩, વાપી-૩૬૬ ૧૧૫
 સિલો વાલસાડ, ગુજરાત. કોર્પોરેટ ઓફીસ: ટોલોગ ટોવન, બીએમ. મુલુડ ગુરુગાંધી, સિકે રોડ, એ.ટી.એસ. રોડ, મુલુડ (મધ્યમ), મુંબઈ-૪૦૦ ૦૮૦

ઇમેલ: investorrelations@arti-industries.com વેબસાઇટ: www.arti-industries.com

માસ સામાન્ય સલાની નોટીસ અને ઇ-વોટીંગની માહિતી

આની નોટીસ આપવામાં આવી છે કે આની ઉપરથી નોટીસ ("કંપની") ના સભ્યોની એક્સ ઓર્ડિનેટી જનરલ મીટિંગ ("ઉપરોક્ત") યોજવામાં, ૧૪ જુન, ૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ વાગે વીડીયો કોન્ફરન્સિંગ ("વીડી") / અથવા ઓફીસો વિડ્યુઅલ માધ્યમો (ઓએવિએમ) દ્વારા નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. કોર્પોરેટ એક્ટ નં. ૧૯/૨૦૨૦ ના ૧૧/૨૦૨૦ ના. ૨ ના અધિકાર, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૩ સુધી, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૪ ના. ૨૦૨૦ (સીએસ) ની અધિકારોને સરક્યુલર) અને સિદ્ધાંતોના આધારે નોટીસમાં જણાવેલા કાર્યો પાસ પાડવા માટે યોજાશે. (સીએસ) દ્વારા જનરલ સરક્યુલર નં. ૧/૨૦૨૦ ના. ૧૩ ઓફીસ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨/૨૦૨૦ ના. ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૦ ના. ૨૨ સુધી, ૨૦

E-AUCTION AEPL NOTICE

(Under Regulation 32 & 33 of IIBBI (Liquidation Process) Regulations, 2016
AMAZON ENTERPRISES PRIVATE LIMITED (Under Liquidation) (AEPL)
 CIN: U51101TG2013PTC088581

Liquidator of AEPL hereby invites Eligible Bidder(s) for participation in E-Auction Sale of Assets of AEPL, listed herein, on "as-is-where-is", "as-is-what-is", "whatever-there-is" and "Non-Recourse" basis as per the schedule listed herein & as per the conditions & Process listed in COMPLETE E-AUCTION PROCESS DOCUMENT available on <https://www.bankerauctions.com> or can be obtained by sending an email to the Liquidator.

DESCRIPTION OF ASSETS	RESERVE PRICE (Rs. Lacs)	EMD(10%) (Rs. Lacs)	Incremental Bid (Rs. Lacs)
S. No. Description of Immovable/ Movable Assets	RESERVE PRICE	EMD	Incremental Bid
Option - A Plot - plot No. 2 in an unnamed layout in Sy No. 179, Suraram Village, Quthbullapur Mandal, Medchal-Malkajgiri District - 1000 Sq.Yds	Rs. 250 lacs	Rs. 25 lacs	Rs.5 lacs/-
Option - B - Programming paper cutting machine - Recycled paper automatic balling machine - Recycled paper grading and strapping machine - Matoba Stitching / Pinning Machine	Rs. 10 lacs	Rs.1 lac	Rs. 50,000/-

E Auction timings on 07th June, 2021 :

Option -A	Option -B
2-4 pm	4-5 pm

Site Visit & Discussion Meeting on 27th May, 2021, from 6.30A.M. to 8.30A.M.
Last Date of Document Submission & EMD payment 30th MAY, 2021 Till 05:00 P.M.
Date/Time of E-Auction - Date: 07th June, 2021 from 02:00 P.M. to 05:00 P.M.

Note: The plot shown at Option-A at present is occupied by a third party claiming to be the owner. Interested Applicants are required to deposit EMD amount through NEFT/RTGS in the EMD A/C No. 157311100003378 in the name of Beneficiary "Amazon Enterprises Private Limited. (Under Liquidation)", Name of the Bank- UNION BANK OF INDIA, IFSC CODE: UBIN0559041, Branch : Banjara Hills, Raod No.4,Hyderabad 500034

* The complete details of the Plot and Plant & Machinery can be sought after signing the confidentiality undertaking with the Liquidator.
 * Interested Applicants are advised to refer the Bid Documents and Submit the complete Bid Documents along with proof of deposit of EMD in hard copy to the Liquidator.
 The Liquidator reserves right to accept or cancel or extend or modify any terms and conditions of the e-auction.

Nethi Mallikarjuna Setty
 (Liquidator)
 In the Matter of AMAZON ENTERPRISES PRIVATE LIMITED.
 Regn. No. IBB/II/PA-001/II-P-01251/2018-19/11958
 Reg. Add.: Flat No 101, Laurel Residency,
 Road No 18, Panchavathi Colony, Manikonda, Hyderabad-500089
 Email: malliknethi@gmail.com
 Contact No. - 9963606444

Date: 23.05.2021
 Place : Hyderabad

DCW LIMITED

Registered office : Dhrangadhra - 363315 (Gujarat)
 Head Office : Nirmaal, Nariman Point, Mumbai - 400021.
 Website : www.dcwlimited.com, Telephone : 2237191416.
 Telefax : 22 22028838, E-mail : ho@dcwlimited.com CIN : L24110GJ1939PLC000748 (₹ in lakhs)

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2021 :

Particulars	Quarter Ended 31.03.2021	Quarter Ended 31.12.2020	Quarter Ended 31.03.2020	Year Ended 31.03.2021	Year Ended 31.03.2020
	(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)
1. Total Income from operations	45,567.95	38,607.98	29,359.09	1,46,426.17	1,27,727.68
2. Net Profit / (Loss) before tax for the period	1,872.07	994.89	(3,590.87)	1,367.51	(3,965.84)
3. Net Profit / (Loss) after tax for the period	646.96	619.59	(2,505.74)	379.31	(2,676.16)
4. Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	605.40	643.74	(2,461.07)	410.21	(2,579.56)
5. Equity Share Capital of face value of ₹ 2/- each.	5,220.61	5,220.61	5,220.61	5,220.61	5,220.61
6. Earning Per Share (of ₹ 2/- each) (for continuing and discontinued operations)					
1. Basic	0.25	0.24	(0.96)	0.15	(1.12)
2. Diluted	0.25	0.24	(0.96)	0.15	(1.12)

NOTES:
 The above is an extract of the detailed format of Standalone Audited Financial Results for the quarter and year ended on 31st March, 2021 filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results for the quarter and year ended 31st March, 2021 are available on the Stock Exchanges websites (www.bseindia.com) and the company website (www.dcwlimited.com).

For and on behalf of the Board of Directors
 Sd/-
 Pramod Kumar Jain
 Chairman & Managing Director
 DIN : 00380458

Place : Mumbai
 Dated : 21st May 2021

DCW LIMITED - Manufacturers of CHEMICALS THAT MAKE INDUSTRIES HUM
 Visit us at : www.dcwlimited.com

CANARA ROBECO

Canara Robeco Mutual Fund

Investment Manager : Canara Robeco Asset Management Co. Ltd.
 Construction House, 4th Floor, 5, Walchand Hirachand Marg, Ballard Estate, Mumbai 400 001.
 Tel.: 6658 5000 Fax: 6658 5012/13 www.canararobeco.com CIN No.: U65990MH1993PLC071003

NOTICE NO. 11

Declaration of dividend under Income Distribution cum Capital Withdrawal ("IDCW") option in Canara Robeco Mutual Fund Schemes:

Notice is hereby given that the Board of Trustees of Canara Robeco Mutual Fund has declared dividend in the following schemes, subject to availability of distributable surplus:

Scheme Name	Investment Option	Dividend (₹ Per unit)	Face Value (₹ per unit)	NAV Per Unit as on 21.05.2021 (₹)
Canara Robeco Corporate Bond Fund	Regular Plan - IDCW (Payout/Reinvestment) Option	0.30	10.00	11.9201
	Direct Plan - IDCW (Payout/Reinvestment) Option	0.30	10.00	12.4116
Canara Robeco Short Duration Fund	Regular Plan - Monthly IDCW (Payout/Reinvestment) Option	0.06	10.00	15.4091
	Direct Plan - Monthly IDCW (Payout/Reinvestment) Option	0.06	10.00	16.9646
Canara Robeco Conservative Hybrid Fund	Regular Plan - Monthly IDCW (Payout/Reinvestment) Option	0.10	10.00	14.1431
	Direct Plan - Monthly IDCW (Payout/Reinvestment) Option	0.10	10.00	15.9613
Canara Robeco Equity Hybrid Fund	Regular Plan - Monthly IDCW (Payout/Reinvestment) Option	0.72	10.00	87.3000
	Direct Plan - Monthly IDCW (Payout/Reinvestment) Option	0.60	10.00	100.6400

Pursuant to payment of dividend, the NAV of the IDCW option of the schemes would fall to the extent of payout and statutory levy (if any).

Record Date for the purpose of distribution of dividend is 28th May, 2021 or the next business day if the record date happens to be a non-business day. All unit holders, under the abovementioned Plan/Option, whose names appear on the register of unit holders of the Scheme as on the record date, are eligible for the dividend. The Dividend declared out of the Distributable Surplus of the abovementioned Schemes will be paid net of tax deducted at source (TDS) as applicable, to those unit holders whose names appear in the register of unit holders as on the Record Date.

Declaration of dividend is subject to availability of distributable surplus on the record date/ex-dividend date. In case the distributable surplus is less than the quantum of dividend on the record date/ex-dividend date, the entire available distributable surplus in the Scheme/plan will be declared as dividend.

SEBI circular no. SEBI/HO/IMD/DF3/CIR/P/2020/194 dated 5th October, 2020 on Review of Dividend option(s)/ Plan(s) in case of Mutual Fund Schemes shall be applicable for calculation of distributable surplus.

In view of individual nature of tax consequences, each investor is advised to consult his/her own professional financial/tax advisor.

Unit holders are requested to visit www.canararobeco.com to claim their amounts remaining unclaimed or unpaid and follow the prescribed procedure therein.

For and on behalf of Canara Robeco Asset Management Company Ltd.
 (Investment manager for Canara Robeco Mutual Fund)
 Sd/-
 Authorised Signatory

Date: 22-05-2021
 Place: Mumbai

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

THE SINGARENI COLLIERIES COMPANY LIMITED

(A Government Company)
 R.O. : Kothagudem Collieries - 507101, Telangana

e-PROCUREMENT TENDER NOTICE

Tenders have been published for the following Services / Material Procurement through e-procurement platform. For details, please visit <https://tender.telangana.gov.in> or - <https://www.sccilimes.com>

NIT/Enquiry No.- Description / Subject / Estimated Contract Value - Last date and time for Submission of bid(s)
E022100067 - Procurement of Operator Seats for various HEMM under Rate contract for a period of two years against Open Enquiry - 10-06-2021-17:00 Hrs. -GM.MP
E072100054 - Procurement of T S Niton XL2+ Handheld XRF Analyser on specific make from OEM M/s Thermo Fisher Scientific or their authorized dealers on open enquiry-15-06-2021-17:00 Hrs. -GM.MP
RG-III/CV/ET-10/2021-22 - Repairs works to JEQ quarters at CNC (GEMMCO SHEDS), RG-III Area-31-05-2021-4:30 PM. - Dy.GM (Civil)/RG-III
RG-III/CV/ET-11 /2021-22- Deployment of contractor's work men's (14800 man shifts) for underground works at ALP, Adriyala Projects Area - 27-05-2021-4:30 PM. - Dy.GM (Civil)/RG-III
CRP/CVL/MNG/ITN-12/2021-22, Dt:18-05-2021 - Construction of Rest hall at PK OC-2 Extension Project at Manuguru area, Bhadradi Kothagudem Dist. Telangana State- Rs. 61.54,107/-, 01-06-2021-4:30 PM. - GM (Civil)
CRP/CVL/RG-ITN-13/2021-22, Dt:20-05-2021 - Providing chain link mesh fencing along the diverted Nallah from new coal corridor road to 2 Incline under bridge at RG-I Area, Godavarikhani, Peddapalli Dist., Telangana State- Rs.1,70,12,335/-, 03-06-2021-4:30 PM. -GM (Civil)
PR/2021-22/MP/CVL/13 R.No.:1812-PP/CL-AGENCY/ADVT/1/2021-22, Dt:22-05-2021

LUMAX Lumax Auto Technologies Limited

CIN: L31909DL1981PLC349793
 Regd. Office: 2nd Floor, Harbans Bhawan-II,
 Commercial Complex, Nangal Raya, New Delhi- 110046 Tel: 0124-4760000.
 Email: shares@lumaxmail.com Website: www.lumaxworld.in/lumaxautotech

TRANSFER OF UNPAID DIVIDEND AND THE UNDERLYING SHARES TO THE INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF)

Dear Shareholder(s),

Pursuant to the provisions of Section 124 of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules"), as amended from time to time, every Company is required to transfer to the Investor Education and Protection Fund (IEPF), the money in the Unpaid Dividend Account of the Company which remains unpaid or unclaimed for a period of 7 (seven) years from the date it was transferred to Unpaid Dividend Account and transfer of shares to IEPF in respect of which dividend remains unpaid or unclaimed for 7 (seven) consecutive years or more to IEPF.

In view of above, we wish to inform you that the due date for transfer into IEPF of the Unpaid/Unclaimed Dividend lying in the Unpaid Dividend Account of the Company for the Financial Year 2013-14 is 27th August, 2021. Accordingly, concerned Shareholders are requested to claim the Unpaid Dividend.

The underlying shares of such Shareholders will also be transferred into the IEPF. After such shares are transferred to the IEPF, all voting rights on the same shall be frozen and you will lose all benefits accruing on your shares e.g. dividend, etc. as this shall also be transferred to the IEPF.

The complete list of Shareholders whose dividend(s) are lying unpaid against their Folio/DP-ID/Client ID, in the Unpaid Dividend Accounts of the Company beginning Financial Year 2013-14 onwards and also those whose shares are due for transfer to the IEPF is being uploaded on the website of the Company at www.lumaxworld.in/lumaxautotech under the Investor Section. The Company has sent individual communication to the concerned shareholders at their registered address whose shares are liable to be transferred to IEPF under the Rules for taking appropriate action(s).

The Company will follow the process as mentioned below:

- For the shares which are in physical form and which are liable to be transferred to the IEPF Authority, the concerned shareholders may note that the Company would be issuing duplicate share certificate(s) in lieu of the original share certificate(s) held by them and upon issue of the duplicate share certificate(s), the original share certificate(s) which are registered in their name will stand automatically cancelled and be deemed as non-negotiable as per the rules. After the issue of duplicate share certificate(s), the Company shall inform the depository by way of corporate action to convert the duplicate share certificate into the Demat form and transfer in favour of the Demat Account of the IEPF Authority.
- For the shares which are in Demat form, the Company will process the transfer of shares through depositories by way of Corporate Action in favour of the Demat Account of the IEPF Authority.

The concerned shareholders whose shares are in physical form may further note that their details uploaded on the website of the Company should be treated and considered as an adequate notice in respect of issue of duplicate share certificate(s) by the Company for the purpose of transfer of shares to the IEPF Authority as per the rules.

In case the Company does not receive any communication from the concerned Shareholders, the Company with a view to adhering with the requirements of the Rules, transfer the dividend to the IEPF and the shares which are liable to be transferred to IEPF by the due date i.e. 27th August, 2021.

Please note that no claim shall lie against the Company in respect of unclaimed dividend amount and shares transferred to IEPF. Shareholders may claim the dividend and corresponding shares transferred to IEPF including all benefits accruing on such shares, if any, from the IEPF authorities after following the procedure prescribed in the Rules.

For any queries on the above matter, Shareholders are requested to contact the Company's Registrar and Share Transfer Agent, M/s Bigshare Services Private Limited, Unit: Lumax Auto Technologies Limited, Bharat Tin Works Building, 1st Floor, Opp. Vasant Oasis, Makwana Road, Andheri-East, Mumbai-400059, Tel: 022 - 62638200, Email ID: vinod_y@bigshareonline.com.

For Lumax Auto Technologies Limited
 Anil Tyagi
 Company Secretary

Place : Gurugram
 Date : 22/05/2021

CASPIAN IMPACT INVESTMENTS PRIVATE LIMITED

CIN: U65993TG1991PTC013491
 Regd Office: 4th Floor, Venture Plaza, Plot No - 40 & 41, Financial District, Gachibowli, Hyderabad - 500032, Telangana, India.
 Tel: +9140 66297100 Email: info@caspiain.in Website: www.caspiaindebt.in

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDED MARCH 31, 2021

(All amounts are in ₹ Lakhs, except for details of EPES and ratios)

S. No	Particulars	Current Year ended 31 March 2021 Audited	Previous Year ended 31 March 2020 Audited
1	Total Income from Operations	5,820.12	6,031.71
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	229.05	460.88
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	229.05	460.88
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	245.72	472.56
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after Tax) and Comprehensive Income (after Tax))	119.57	480.53
6	Paid up Equity Share Capital	666.61	652.30
7	Reserves (excluding Revaluation Reserve)	16,526.94	15,936.09
8	Net worth	17,193.55	16,588.39
9	Outstanding debt	38,551.29	30,953.70
10	Debt/Equity Ratio	2.24	1.87
11	Earnings Per Share (of ₹ 10 each)		
	(a) Basic (₹)	3.72	7.24
	(b) Diluted (₹)	3.72	7.24
12	Capital Redemption Reserve	163.44	163.44
13	Debenture Redemption Reserve (Refer Note 3)	N.A.	N.A.
14	Debt Service Coverage Ratio (Refer Note 4)	N.A.	N.A.
15	Interest Service Coverage Ratio (Refer Note 4)	N.A.	N.A.

Notes:

- The above is an extract of the detailed format of audited annual financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirement) Regulations, 2015. The full format of the annual financial results are available on the website of the Stock Exchange at www.bseindia.com and on Company's website at www.caspiaindebt.in
- The financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") notified under Section 133 of the Companies Act 2013 ("the Act") read with the Companies (Indian Accounting Standards) Rules, 2015, as amended from time to time.
- Debenture redemption reserve is not required in respect of privately placed debentures in terms of Rule 18(7)(b)(iii)(B) of Companies (Share Capital and Debenture) Rules 2014.
- Debt service coverage ratio and interest service coverage ratio is not applicable for Non Banking Finance Company (NBFC) and accordingly no disclosure has been made.

For Caspian Impact Investments Private Limited
 Sd/-
 S. Viswanatha Prasad
 Managing Director
 DIN: 00574928

Place : Hyderabad
 Date : 21 May 2021

FRANKLIN TEMPLETON

Franklin Templeton Mutual Fund

Indiabulls Finance Center, Tower 2, 12th and 13th Floor, Senapati Bapat Marg, Elphinstone Road (West), Mumbai 400013

Income Distribution cum capital withdrawal (IDCW) in the Franklin India Equity Hybrid Fund

The Trustees of Franklin Templeton Mutual Fund have decided to distribute the following Income Distribution cum capital withdrawal (IDCW):

Name of the Schemes / Plans	Face Value per Unit (₹)	Amount of IDCW per Unit* (₹)	NAV per Unit as on May 20, 2021 (₹)
Franklin India Equity Hybrid Fund (FIEHF)			
FIEHF- IDCW	10.00	1.75	24.9412
FIEHF- IDCW - Direct			28.0829

The Record Date for the same will be May 28, 2021 (Friday). If in case the Record Date falls on a non-Business Day, the immediately following Business Day shall be the Record Date. All the Unit holders / Beneficial Owners of the IDCW plan / option of the scheme whose names appear in the records of Registrar / Depositories as on the Record Date shall be entitled to receive IDCW. The investors in the IDCW re-investment plan/option will be allotted units for the IDCW amount at the NAV of next Business Day after the Record Date.

Please note that the IDCW payout shall be subject to the availability of distributable surplus and if the available distributable surplus as on the record date is lower than the aforementioned IDCW rate, then the available distributable surplus shall be paid out. The payout shall be subject to tax deducted at source i.e. TDS, as applicable.

Pursuant to payment of IDCW, the NAV of the scheme would fall to the extent of payout and statutory levy (if applicable).

For Franklin Templeton Asset Management (India) Pvt. Ltd.
 (Investment Manager of Franklin Templeton Mutual Fund)

Sd/-
Sanjay Sapre
 President
 Date: May 22, 2021

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

NOTICE

DSP MUTUAL FUND

NOTICE is hereby given that DSP Trustee Private Limited, the Trustee to DSP Mutual Fund ("Fund") has approved the distribution under Income Distribution cum Capital Withdrawal ("IDCW") Option(s) of the below mentioned scheme(s) of the Fund, the particulars of which are as under:

Record Date: May 28, 2021

Name of Scheme(s)	Plan(s)	Option(s)	Quantum of IDCW (Rs. per Unit)	Face Value (Rs. per Unit)	NAV as on May 20, 2021 (Rs. per unit)
DSP Equity & Bond Fund	Regular	IDCW	0.150	10	25.295
DSP Equity & Bond Fund	Direct	IDCW	0.150	10	49.033

Distribution of the above IDCW is subject to the availability and adequacy of distributable surplus.

Pursuant to payment of IDCW, the NAV of the IDCW Option(s) of the aforesaid Scheme(s) of the Fund would fall to the extent of payout and statutory levy, if any.

Amount will be paid to all those Unit Holders/Beneficial Owners whose names appear in the records of the Registrar and Transfer Agent, Computer Age Management Services Limited/statement of Beneficiary Owners maintained by the Depositories under the IDCW Option(s) of the aforesaid Scheme(s) as on the Record Date. The Payout shall be subject to tax deducted at source (TDS) as applicable.

Unit holders are advised to update any change of address / bank details, if any, with depository participant(s) in advance of the Record Date.

Any queries/clarifications in this regard may be addressed to:
DSP Investment Managers Private Limited ("AMC")
 CIN: U74140MH1996PTC099483
 Investment Manager for DSP Mutual Fund
 Mafatal Centre, 10th Floor, Nariman Point, Mumbai 400 021
 Tel. No.: 91-22 66578000, Fax No.: 91-22 66578181
 Toll Free No: 1800 200 4499, www.dspim.com

Unit holders are requested to update their PAN, KYC, email id, mobile number and nominee details with the AMC as well as check for any unclaimed redemptions or IDCW payments.

Place: Mumbai
 Date: May 22, 2021

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.